

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય, ગાંધીનગરના નિયંત્રણ હેઠળની નિયામકશ્રી નગરપાલિકાઓ, ગાંધીનગર નીકચેરી હસ્તકની “મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગની સીધીભરતી માટે, જાહેરાત ક્રમાંક: ૧૧૧/૨૦૧૬૧૭ અને “મ્યુનિસિપલ ડેપ્યુટીએકાઉન્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટે, જાહેરાત ક્રમાંક: ૧૧૨/૨૦૧૬૧૭ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા.૦૩/૦૯/૨૦૧૭ ના રોજ યોજવામાં આવેલ હતી. ઉક્ત સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે જે તે સંવર્ગમાં ભરવાની થતી જગ્યાઓના કેટેગરીવાઇઝ મેરીટના ધોરણે ત્રણ ગણા ઉમેદવારો (૪૦% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં ઉપલબ્ધ ઉમેદવારો)ને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ગણવામાં આવેલ છે અને તેઓની યાદી મંડળની વેબસાઇટ પર તા.૨૨/૧૨/૨૦૧૭ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

ઉક્ત સંવર્ગની ભાગ-૨ની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો કાર્યક્રમ નીચે મુજબ નિયત થયેલ છે.

ક્રમ	જાહેરાત ક્રમાંક / સંવર્ગનું નામ	પરીક્ષાની તારીખ	પરીક્ષાની વિગત
૧	૧૧૧/૨૦૧૬૧૭, “મ્યુનિસિપલએકાઉન્ટન્ટ”	૨૫/૦૧/૨૦૧૮	ભાગ-૨ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ
૨	૧૧૨/૨૦૧૬૧૭, “મ્યુનિસિપલ ડેપ્યુટીએકાઉન્ટન્ટ”	૨૬/૦૧/૨૦૧૮	ભાગ-૨ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ

કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનું સ્થળ અને સમય તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલાં મંડળની વેબસાઇટ <https://gsssb.gujarat.gov.in> પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

(૧) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો અભ્યાસક્રમ અને ગુણભાર :-

જાહેરાત ક્રમાંક: ૧૧૧/૨૦૧૬૧૭ અને જાહેરાત ક્રમાંક: ૧૧૨/૨૦૧૬૧૭ માટે

સમય - ૧-૧૫ કલાક		
પ્રશ્ન ક્રમાંક	વિષયનું વિવરણ	ગુણ
૧	એક્સેલ સ્પ્રેડશીટ	૧૫ ગુણ
૨	ઈ-મેઇલ કરવા (વીથ ફાઇલ એટેચમેન્ટ)	૧૫ ગુણ
૩	પાવર પોઇન્ટ	૧૫ગુણ
૪	વર્ડ ટાઇપીંગ/ વર્ડ ફોર્મેટીંગ (અંગ્રેજી તથા ગુજરાતી)	૩૦ ગુણ
	કુલગુણ	૭૫ગુણ

નોંધ:- પ્રશ્ન ક્રમાંક- ૧, ૨ તથા ૩ અંગ્રેજી ભાષામાં રહેશે અને પ્રશ્નપત્ર હાર્ડ કોપીમાં આપવામાં આવશે. પરંતુ પ્રશ્ન ક્રમાંક - ૨ માં ફાઇલ એટેચમેન્ટ સોફ્ટ કોપીમાં રહેશે. પ્રશ્ન ક્રમાંક ૪ માં વર્ડ ટાઇપીંગગુજરાતી ભાષામાં રહેશે અને પ્રશ્નપત્ર હાર્ડ કોપીમાં આપવામાં આવશે, જ્યારે વર્ડ ફોર્મેટીંગ અંગ્રેજી ભાષામાં સોફ્ટ કોપીમાં રહેશે. અને વર્ડ ફોર્મેટીંગના કમાન્ડ હાર્ડ કોપીમાં આપવામાં આવશે.

- (૨) આ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માઈક્રોસોફ્ટ ઓફીસ ૨૦૦૭ના વર્ઝન (Version)માં લેવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ગુજરાતી ભાષા માટે ફોન્ટ શ્રુતી અને માઈક્રોસોફ્ટ ઈન્ડીક લેન્ગવેજ ઈનપુટ ટુલ-૩ રહેશે. આ સોફ્ટવેરમાં નીચે મુજબના આઠ (૮) કી-બોર્ડ ઉપલબ્ધ છે.

1. Gujarati Transliteration
2. Gujarati Typewriter
3. Gujarati Typewriter (G)
4. Gujarati Inscript
5. Gujarati Indica
6. Remington Indica
7. Special Characters
8. Gujarati Terafont

- (૩) વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઈલ) ની પરીક્ષા સોફ્ટવેર દ્વારા ખોલી આપવામાં આવેલ વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઈલ) માં જ આપવાની રહેશે. વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ અને આઉટલુક (ઈ-મેઈલ) પરીક્ષામાં ઉમેદવારે કોઈ ફાઈલ બનાવવાની રહેશે નહીં. એ ફાઈલ સોફ્ટવેર દ્વારા ઓટોમેટીક બનશે. જો કોઈ ઉમેદવાર પરીક્ષાના સોફ્ટવેર સિવાય ફાઈલ ઓપન કરી લખશે તો ઉમેદવારનું પરીણામ માન્ય ગણાશે નહીં.
- (૪) ઉમેદવારને કી બોર્ડ, માઉસ, કોમ્પ્યુટર મંડળ તરફથી ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારને પોતાનું કી બોર્ડ લાવવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી શરૂ થતાં પહેલા અને પરીક્ષા ખંડમાં પ્રવેશ્યા બાદ આપને ફાળવેલ કોમ્પ્યુટર કી બોર્ડ, માઉસ, કોમ્પ્યુટર બરાબર ચાલે છે તેની ખાત્રી કરી લેવાની રહેશે.
- (૫) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી સમયે કોમ્પ્યુટરમાં કોઈ ટેકનીકલ ખામી જણાય તો ઉમેદવારે અન્ય ઉમેદવારને ખલેલ પહોંચાડ્યા વગર તેમજ પોતે કોઈ પગલાંઓ લીધા વગર પોતાનું સ્થાન જાળવી રાખીને (ઉભા થયા વગર) વર્ગ નિરીક્ષક (ઇન્વીજીલેટર) ને જાણ કરવાની રહેશે.
- (૬) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી માટે એક જ વાર “Log in”થઈ શકાશે. પરીક્ષાનો સમય ૧-૧૫ કલાક પૂરો થયા પહેલા ઉમેદવાર પોતે “ Submit “કરી દેશે. તો ફરીથી “ Log in “થઈ શકશે નહીં. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો સમય ૧-૧૫ કલાક બાદ સમય પૂર્ણ થવાના કારણે ટાઇપ થવાનું આપોઆપ બંધ થઈ જશે. એ સમય પહેલા જો ઉમેદવાર Confirm / Accept કરીને તેમનું ટાઇપ કામ સબમીટ (Submit) કરી દેશે તો તે પછી ટાઇપ કામ થઈ શકશે નહીં.
- (૭) પ્રશ્નપત્રના પ્રશ્ન ક્રમાંક ૧ થી ૪ અંતર્ગત તેના જવાબ માં કરવામાં આવેલ ભૂલો જેવી કે, સ્પેલીંગ / જોડણીની ભૂલ, માર્જિન સેટીંગ, ફોન્ટ સાઇઝ, ટાઇપકામ ની ભૂલ બાબતે માર્કિંગ, મંડળના નિર્ણય અનુસાર કરવામાં આવશે.

- (C) આખરી પરિણામ, પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તથા બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી એમ બંને કસોટીમાં ઉમેદવારે મેળવેલ સંયુક્ત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ લાયકી ગુણ (**Minimum qualifying marks**)નું ધોરણ દરેક કેટેગરી ના ઉમેદવારો માટે ૪૦% (ચાલીસ ટકા) ગુણનું નિયત થયેલ છે.
- (D) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનું પરિણામ કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ આધારીત હોઇ, તેના રીચેકીંગ અંગેની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ

સ્થળ:- ગાંધીનગર
તા.૨૭/૧૨/૨૦૧૭

સચિવ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ગાંધીનગર.